

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન અને અમાલગમેટેડ ટ્રાન્ઝિટ યુનિયન (Amalgamated Transit Union) 1573

દ્વારા

સામુહિક કરારને બહાલી આપવામાં આવી

બ્રેમ્પટન, ઓન્ટારિયો (10 જુલાઈ 2019) – સીટી ઓફ બ્રેમ્પટન અને અમાલગમેટેડ ટ્રાન્ઝિટ યુનિયન (ATU) લોકલ 1573 એ નવા સામુહિક કરારને બહાલી આપી જે 01 જુલાઈ 2019 – 30 જૂન 2024 અમલી રહેશે. આજની સભામાં અંતિમ રૂપ આપીને કાઉન્સિલે નવા કરારને મંજૂરી આપી.

1976 થી સેવામાં રત બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કનેડાનાં ટ્રાન્ઝિટ પ્રદાતાઓ પૈકી સૌથી ઝડપી વિકાસ પામનાર પ્રદાતા છે. 2018માં 31 મિલિયન કરતા વધુ મુસાફરોનું પરિવહન કરીને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ તેના સવારોને બ્રેમ્પટન તેમજ ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં રહેલાં મુખ્ય આકર્ષણો અને ગંતવ્ય સ્થળો સુધી સફર કરાવી શક્યા હતાં.

સવારીનાં આંકડા:

- સરેરાશ સપ્તાહનાં ચાલુ દિવસોની સવારીઓ: 1,16,000*
- સરેરાશ સાપ્તાહિક સવારીઓ: 6,71,000*
- સરેરાશ માસિક સવારીઓ: 2,603,256**

*સપ્ટેમ્બર, ઓક્ટોબર, અને નવેમ્બર 2018નો સરેરાશ

**2018થી 12 મહિનાનો સરેરાશ

અવતરણો

"બ્રેમ્પટન ટ્રાન્ઝિટ દેશની સૌથી ઝડપી વિકસી રહેલ ટ્રાન્ઝિટ સિસ્ટમો પૈકી છે. મને તે જોઈ આનંદ થાય છે કે અમે યુનિયનમાં જોડાયેલ સીટીનાં ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ કર્મચારીઓ સાથેનાં સામુહિક કરારને બહાલી આપી શક્યા છીએ. પ્રત્યેક દિવસે 110,000 કરતા વધુ સવારીઓ બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરે છે અને આ કરાર તેમનો સફર ચાલુ રાખશે. વાટાઘાટ પ્રક્રિયામાં સામેલ પ્રત્યેક વ્યક્તિને તેઓની બ્રેમ્પટન નિવાસીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેમની સખત મહેનત માટે હું આભાર માનું છું."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન ટ્રાન્ઝિટની અગ્રિમતા આપણા લોકો છે ખાસ કરીને અમારા કર્મચારીઓ અને સવારીઓની સુરક્ષા. અમારી સેવાઓ આગળ વધારવા અને અમારા મુસફરોને આગામી પાંચ વર્ષ સુધી સુરક્ષિત, વિશ્વસનીય અને ગુણવત્તાસભર સિસ્ટમ પૂરી પાડવા અમે અમાલગમેટેડ ટ્રાન્ઝિટ યુનિયન 1573 સાથે કાર્ય કરવાની આશા વ્યક્ત કરીએ છીએ."

- આલેક્સ મિલોયોવિચ, જનરલ મેનેજર, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

"અમાલગમેટેડ ટ્રાન્ઝિટ યુનિયન 1573 આ નવા કરારથી ખુશ છે. મુસાફરો અને નિવાસીઓને એક સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સિસ્ટમ પૂરી પાડવા સીટી ઓફ બ્રેમ્પટન સાથે કાર્ય કરતા રહેવા અમે આનુર છીએ."

- રોબ ગુડી, પ્રમુખ, અમાલગમેટેડ ટ્રાન્ઝિટ યુનિયન (ATU) લોકલ 1573

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca